

નવેમ્બર 6, 2018

સ્ટાર્ટઅપ વીકએન્ડ આયોજને બ્રામ્પટનમાં સંખ્યાબંધ સંભવિત નવા ધંધાઓને પ્રેરણા પૂરી પાડી

બ્રામ્પટન, ઓન્ટેરિયો – આ વિતેલા અઠવાડિક રજાઓના દિવસો દરમિયાન રોમાંચક અને આકરા 54 કલાકમાં, બ્રામ્પટન સીટી હોલમાં આઠ ધંધાઓએ કલ્પનાથી સંભવિત વાણીજ્યકરણમાં અંપલાવ્યું.

સીટી ઓફ બ્રામ્પટન અને બ્રામ્પટન એન્ટરપ્રીન્યુર સેન્ટરે, સ્ટાર્ટઅપ પીલ સાથેની ભાગીદારીમાં, ગત નવેમ્બર 2-4 વચ્ચે પીલ રીજીયન ઈન્ટરનેટ ઓફ થીંગ્સ (IoT) ટેકસ્ટાર્સ ગ્લોબલ સ્ટાર્ટઅપ વીકએન્ડ 2018 નું આયોજન કર્યું, જેમાં 100 ઉપરાંત ડિઝાઇનર્સ, ડેવલપર્સ, માર્કેટર્સ અને એન્ટરપ્રીન્યુર્સ – જેમાં અડધા ઉપરાંત બ્રામ્પટનના હતા - પોતાના મૌલિક વિચારોની આપલે કરવા, ટીમો બનાવવા અને ટેક સ્ટાર્ટઅપ્સ બનાવવા સૌ ભેગા થયા.

પીલ રીજીયનમાંથી ચોવીસ જેટલી નવીન શોધ કરવા પ્રેરિત વ્યક્તિઓએ જજીસની પેનલ સમક્ષ પોતાના ધંધાકીય વિચારો રજૂ કરીને વીકએન્ડની શરૂઆત કરી. જેમાંના આઠ વિચારોને પસંદ કરવામાં આવ્યા, અને સહભાગીઓ, કોચ અને મેન્ટર્સ શરૂઆતના ધંધાકીય વિચારોને મીનીમમ વાયેબલ પ્રોડક્ટ્સ (MVP) અને સર્વિસીસમાં બદલવાનો હેતુ ધરાવીને, વીકએન્ડના સમયગાળા દરમિયાન એકબીજા વચ્ચે સહયોગ ઊભો કર્યો.

વીકએન્ડની મોટી ઝાંખી એ જોવામાં આવી જ્યારે ઓફસેટ માર્કેટ એક્સચેન્જ (OMX) સંસ્થાપક પ્રખ્યાત ધંધાકીય સાહસિક નિકોલ વર્કિન્ડટ અને CBC ના *Next Gen Den* (નેક્સ્ટ જન ડેન) પર સૌથી નવા “ડ્રેગન” પિચ નાઈટ પર નવીન શોધના મહત્વ વિશે બોલ્યા. અઠવાડિક રજાઓમાં ઉદભવેલી ધંધાકીય પરિકલ્પનાઓનો અભિપ્રાય બાંધવા વર્કિન્ડટ સાથે નાણાકીય સેવાઓના એક્ઝિક્યુટિવ અને સ્ટાર્ટઅપ્સ માટેના એડવાઈઝર પ્રીતિ મલિક, ફાઉન્ડર અને કેટાલીસ્ટ બ્રાયન લી અને પરપઝકૂલ સેલિંગના સંસ્થાપક જોન નિકરસન જોડાયા.

રવિવારે રાત્રે, ત્રણ વિજેતા પીચ પસંદ કરવામાં આવી. વિજેતાઓએ ધંધાકીય શિક્ષણ, પ્રિન્ટ સેવાઓ, સભ્યપદો અને ગ્રીફ્ટ કાર્ડ્સ સહિતના પોતાના ધંધાઓ, માલસામાન અને સર્વિસીસના પેકેજીસ શરૂ કરવામાં મદદ મેળવવા, કુલ \$10,000 રકમના રોકડ ઇનામો મેળવ્યા જેથી ધંધાકીય શરૂઆત અને વિકાસને ટેકો મળી રહે.

પહેલું પગલું: બીપ

સંખ્યાબંધ બ્રામ્પટન રહેવાસીઓ વિજેતા ટૂકડીનો ભાગ બન્યા જેણે IoT ટેકનોલોજીનો ઉપયોગ કરતું સંપૂર્ણપણે કાર્યરત સ્માર્ટ ઍલાર્મ ક્લોકનું પ્રોટોટાઈપ બનાવ્યું. લક્ષ્ય શું હતું? શારીરિક રીતે સૂતેલી વ્યક્તિને જગાડીને પથારીમાંથી ઊભી કરવી, ખાતરી કરાવવી કે તમે સમયસર, દરેક સમયે જાગી જાવ છો.

આ ટીમમાં પર્મવીર બોલા, પ્રિયદર્શિની સાહા, જેકેલીન ટ્રોન્ગ, મુકીથ ખાન અને રોમ રામોસ સામેલ હતા. મનોરંજનમય હકીકત: આ પાંચમાંથી બે સભ્યોની ઉંમર 14 વર્ષથી ઓછી છે.

બીજું સ્થાન: ઍ-ટ્રેક

ઓન-ડિમાન્ડ સર્વિસીસની ખ્યાતિ પર આગળ વધતી, ઍ-ટ્રેક એક એવી એપ્લિકેશન છે જે ટ્રાન્ઝિટ યુઝર્સને વાસ્તવિક-સમયે (રિયલ-ટાઈમ) માર્ગમય માહિતીનું (ટ્રાન્ઝિટ ઈન્ફર્મેશનનું) પગેરું રાખવાની અને તેની જાણ કરવાનું સામર્થ્ય આપે છે. તેમાં ચોક્કસ બસોનું સ્થાન, અને ક્ષમતાનો સમાવેશ થાય છે. આ એપનો હેતુ ટ્રાન્ઝિટ યુઝર્સને પોતાના પરિવહનની વાત આવે ત્યારે વધારે માહિતગાર નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવાનો છે.

આ સમૂહમાં અભય રંધાવા, આરયા આડ, એડમન્ડ લેમ, જેકોબ મેક્સાવાન્ડ અને નાથન કૌલાસ સામેલ હતા.

ત્રીજુ સ્થાન: StoAR

વાસ્તવિક અને વધારેલી હકીકતની ખ્યાતિ વધારતા રહેતા, StoAR (સ્ટોર) નાના અને મધ્યમ કદના ધંધાઓ માટે એક વધારેલા વાસ્તવિક પ્લેટફોર્મ મારફતે પોતાના ઉત્પાદો દેખાડવાનું એક સરળ સાધન છે. StoAR નો વિચાર એક અંગત ખરીદનાર તરીકે કરો – આ એપ રિટેલ સ્ટોરની અભરાઈઓ કે રેસ્ટોરન્ટનું મેનુ પ્રત્યક્ષપણે જોતી વખતે ખરીદનારાઓ ખરીદવા ઇચ્છી શકે તેવા ઉત્પાદો વિશેની માહિતી તેઓને પૂરી પાડવા વધારાની હકીકતનો ઉપયોગ કરે છે.

ટીમ સભ્યોમાં માર્ટિના સાર્થમન્ડ્સ, પરમ ઠક્કર, ક્રિસ ઉજ્જમોટો, કાર્થિક રમેશકુમાર, શંગીયાન પ્રબાહરન અને એમાદ અલી સામેલ હતા.

અવતરણો (ક્વોટ્સ):

“ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકએન્ડને બ્રામ્પટનમાં આ વર્ષે બહુ સફળતા મળી હતી. સંખ્યાબંધ ધંધાકીય સાહસિકો પોતાના ધંધાઓને આગામી સ્તર સુધી લઈ જવા, કોચ અને મેન્ટર્સ સાથે જોડાવા અને છેવટે બ્રામ્પટનના ઉત્સાહી સાહસિક સમુદાયનો ભાગ બનવા પ્રેરિત થયા હતા.”

- કાઉન્સિલર જેફ બોમેન (Jeff Bowman), ઇકોનોમિક ડેવલપમેન્ટ - ચેર (આર્થિક વિકાસ - પ્રમુખ)

“શરૂઆત કરવાનો સૌથી અઘરો ભાગ પ્રસ્થાન કરવાનો છે. ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકએન્ડ્સ ઔદ્યોગિક આગેવાનો પોતાનો વિચાર MVP ને પહોંચાડે તે માટે સહભાગીઓને સુરક્ષિત સ્થાન, તક અને માર્ગદર્શન પૂરું પાડે છે. આજે આપણને ઉપયોગાધિન ઘણી કંપનીઓની સ્થાપના ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકએન્ડ્સમાં થઈ હતી.”

- મેલોની કેમ્પબેલ, સામુદાયિક આગેવાન, સ્ટાર્ટઅપ પીલ

-30-

ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકએન્ડ વિશે

ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકએન્ડ એક 54-કલાકનું આયોજન હોય છે જ્યાં હાજર રહેતી વ્યક્તિઓ અઠવાડિક રજાઓમાં કંપની કેવી રીતે ઊભી કરવી તે શીખે છે. વર્ષ 2007 થી, ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકએન્ડ 200,000 ઉપરાંત લોકો સાથે 150 ઉપરાંત દેશોમાં યોજાયું છે. સહભાગીઓ પોતાના ઉત્પાદ કે ધંધાના વિચારને આગામી સ્તરે પહોંચાડે છે અને ધંધાકીય સાહસિકોના વિશાળ દુનિયાભરના નેટવર્કમાં જોડાય છે.

બ્રમ્પટન વિશાળ આયોજનો વિશે વિચારો છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

ક્રિસ્ટિન શર્મા (Christine Sharma)

મિડિયા રિલેશન્સ

સીટી ઓફ બ્રમ્પટન

905.874.2880 | christine.sharma@brampton.ca